



THE KAPOL CO-OPERATIVE BANK LTD.

(MULTI-STATE SCHEDULED BANK)

R. O. :- 19/21 Kapol Bank Bldg., Picket Cross Road, Kalbadevi,
Mumbai - 400 002.

तारीख / Date _____

यालु खाता नं. _____

Current A/c. No. _____

खातानुं नाम _____

TITLE OF ACCOUNT _____

सहीनो नमुनो _____

SPECIMEN SIGNATURE _____

भास सूचना _____

SPECIAL INSTRUCTIONS _____

सरनामु _____

ADDRESS _____

ओळभाण _____

INTRODUCED BY _____

सरनामु _____

ADDRESS _____

P.T.O

Acctt.

Accountant / Manager

Officer

मालीक भागीदारोना नाम
PROPRIETOR / PARTNERS
अधिकारी

OFFICE BEARERS
(नाम अने होदा साथे)
(WITH NAMES & DESIGNATION)

सहीनो नमुनो
SPECIMEN SIGNATURE

અમે ઘોષણા કરીએ છીએ કે:

We declare that:

i) અમે કોઈપણ બેંકમાં કોઈ જ ક્રેડિટ સુવિધા ધરાવતા નથી.

i) We do not enjoy any credit facilities with any Bank

ii) હાલ અમે અન્ય બેંકમાં નીચે જણાવેલી ક્રેડિટ સુવિધાઓ ધરાવીએ છીએ.

ii) We enjoy the following credit facilities with other Banks at present :

<u>બેંકનું નામ</u>	<u>સુવિધાનો પ્રકાર</u>	<u>રકમ</u>
Name of the Bank	Nature of facility	Amount

1.

2.

3.

હું/અમે આવા ખાતાના સંચાલન માટે બેંકના નિયમો (સમયાંતરે સુધારો કરાયેલા)નું પાલન કરવા અને તેને બંધનકર્તા રહેવા સહમત થાઉં છું / થઈએ છીએ.
I/We agree to comply with and be bound by the Bank's Rules (as amended from time to time) for the conduct of such account.

અમે બેંકને અમારા વતી બિલો / ચેક ઇત્યાદિ મેળવવા અધિકૃત કરીએ છીએ તથા આ સંદર્ભે નીચે જણાવેલા નિયમો અને શરતોનું પાલન કરવા તથા બંધનકર્તા રહેવા સ્વીકારીએ છે.
We authorize the Bank to collect bills, cheques, etc. for and on behalf of us and undertake to abide by & be bound by the Terms & Conditions in this behalf, mentioned below -

ચેક / બિલ અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ મેળવવા વિશેના નિયમો અને શરતો.

બેંક તેના વિકલ્પે પરંતુ અકાઉન્ટ ધારકના જોખમે અને જવાબદારીએ-

1. અકાઉન્ટ ધારક દ્વારા સમય સમયે લોજ કરાતા ઇન્સ્ટ્રુમેન્ટોની આવક મેળવશે.
2. અકાઉન્ટ ધારક દ્વારા લોજ કરાયેલા ઇન્સ્ટ્રુમેન્ટોની આવક મેળવવા એજન્ટ/ટોની નિમણૂક કરશે અને નિયુક્ત કરાયેલા આ એજન્ટો આવા ઇન્સ્ટ્રુમેન્ટ મેળવવા અકાઉન્ટ ધારકના એજન્ટ/ટો રહેશે.
3. અકાઉન્ટ ધારક દ્વારા જમા કરાયેલા ઇન્સ્ટ્રુમેન્ટોની આવક બેંક ડ્રાફ્ટ / ચેક અથવા રોકડને બદલે અન્ય કોઈ પ્રકારે પ્રાપ્ત કરશે.
4. ઇન્સ્ટ્રુમેન્ટોની આવક જમા કરવા જરૂરી જણાય તે પગલા લેશે.
5. બેંક આ દ્વારા વિવિધ ચાર્જિસ જે કોઈ હોય તો તે અકાઉન્ટ ધારકના ખાતામાં ડેબિટ કરી વસૂલવાની સત્તા ધરાવે છે.

Terms and conditions regarding collection of Cheques / Bills & Other Instruments.

The Bank at its option but at the risk & responsibility of the account holder may -

1. Collect proceeds of the instruments lodged by the Account holder from time to time
2. Appoint an agent/s to collect the proceeds of the instruments lodged by the Account holder and as such agent/s appointed shall be the agent/s of the Account holder to collect such instruments.
3. Recover proceeds of instruments lodged by the Account holder by way of Bank Drafts / Cheques or any other Mandate in lieu of cash.
4. Take action / steps as deemed necessary to have proceeds of the instruments lodged.
5. The Bank is hereby empowered to recover the various charges, if any, by debiting the same to the account holder.

કૃપા કરી ફોટોગ્રાફ
લગાવી તેના પર સહી કરો
Please affix photograph
with Signature Across

નમૂના હસ્તાક્ષર
Specimen Signature

નામ: _____
Name:

કૃપા કરી ફોટોગ્રાફ
લગાવી તેના પર સહી કરો
Please affix photograph
with Signature Across

નમૂના હસ્તાક્ષર
Specimen Signature

નામ: _____
Name:

કૃપા કરી ફોટોગ્રાફ
લગાવી તેના પર સહી કરો
Please affix photograph
with Signature Across

નમૂના હસ્તાક્ષર
Specimen Signature

નામ: _____
Name:

કૃપા કરી ફોટોગ્રાફ
લગાવી તેના પર સહી કરો
Please affix photograph
with Signature Across

નમૂના હસ્તાક્ષર
Specimen Signature

નામ: _____
Name:

કૃપા કરી ફોટોગ્રાફ
લગાવી તેના પર સહી કરો
Please affix photograph
with Signature Across

નમૂના હસ્તાક્ષર
Specimen Signature

નામ: _____
Name:

કૃપા કરી ફોટોગ્રાફ
લગાવી તેના પર સહી કરો
Please affix photograph
with Signature Across

નમૂના હસ્તાક્ષર
Specimen Signature

નામ: _____
Name:



The Kapol
Co-operative
Bank Ltd.

(MULTI-STATE SCHEDULED BANK)
ALL YOU WANT A BANK TO BE

પ્રોપરાઈટરશિપ પેઢી દ્વારા ઘોષણા પત્ર
Letter of declaration from Proprietorship Concern

ઘ કપોલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ
The Kapol Co-operative Bank Ltd.

શાખા :
Branch : _____

સુજ્ઞ શ્રી,
Dear Sir,

વિષય: ના નામનું નવું ખાતું ખોલવા બાબતે

Re: Opening of a new account in the name of _____

તમે ખોલેલા ઉપર જણાવેલા ખાતા સંદર્ભે હું નીચે મુજબ ઘોષણા કરું છું :

We refer to the captioned account opened by you and declare as under:

હું, નીચે સહી કરનાર પેઢીનો સોલ પ્રોપરાઈટર છું અને તેની બધી જવાબદારીઓ માટે એકમાત્ર સંપૂર્ણ જવાબદાર છું. પેઢીના બંધારણમાં થતા કોઈપણ ફેરફાર વિશે હું તમને લેખિતમાં જાણ કરીશ તથા તમારી બુક્સમાં પેઢીના નામે રહેલી કોઈપણ જવાબદારી માટે મને તે બદલની સૂચના મળ્યાની તારીખે અને આ જવાબદારીઓ પૂર્ણ ન કરવામાં આવે ત્યાં સુધી હું તમને જવાબદાર રહીશ.

I, the undersigned, am the sole proprietor of the concern and am solely responsible for liabilities thereof. I shall advise you in writing of any change that take place in the constitution of the concern and I will be liable to you for any obligation which may be standing in the name of concern in your books on the date of the receipt of such notice and until all such obligations shall have been liquidated.

આપના વિશ્વાસુ Yours faithfully,

વ્યક્તિની સહી :

Personal Signature : _____

નામ :

Name : _____ પેઢી વતી સહી
Signature on behalf of the Concern

ભાગીદાર પેઢી દ્વારા ઘોષણા

Letter of declaration from Partnership firm

ઘ કપોલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ
The Kapol Co-operative Bank Ltd.

શાખા :
Branch : _____

સુજ્ઞ શ્રી,
Dear Sir,

વિષય: ના નામનું નવું ખાતું ખોલવા બાબતે

Re: Opening of a new account in the name of _____

તમે ખોલેલા ઉપર જણાવેલા ખાતા સંદર્ભે હું નીચે મુજબ ઘોષણા કરું છું :

We refer to the captioned account opened by you and declare as under:

અમે, નીચે સહી કરનાર પેઢીમાં ભાગીદારો છીએ અને તેની જવાબદારીઓ માટે સંયુક્ત અને વ્યક્તિગત રીતે જવાબદાર છીએ. ભાગીદારીમાં થતા કોઈપણ ફેરફાર વિશે અમે તમને લેખિતમાં જાણ કરીશું તથા તમારી બુક્સમાં પેઢીના નામે રહેલી કોઈપણ જવાબદારી માટે તે બદલની સૂચના મળ્યાની તારીખે અને આવી બધી જ જવાબદારીઓ પૂર્ણ ન કરવામાં આવે ત્યાં સુધી બધા જ વર્તમાન ભાગીદારો તમને જવાબદાર રહેશે.

We, the undersigned are the only partners in the firm and are jointly and severally responsible for liabilities thereof. We shall advise you in writing of any change that take place in the partnership and all the present partners will be liable to you on any obligation which may be standing in the firm's name in your books on the date of the receipt of such notice and until all such obligations shall have been liquidated.

અમે ઘોષણા કરીએ છીએ કે ભાગીદારી રજિસ્ટર્ડ કરેલ છે.

We declare that the Partnership is registered.

ભાગીદારોનું પુરું નામ

Full Name of all the Partners

વ્યક્તિગત સહી

Individual Signatures

પેઢી વતી સહી

Signatures on behalf of the firm

For

Partners

પરિચય વિગતો:

INTRODUCTION DETAILS:

પરિચયકર્તાનું નામ:

Introducer's Name: _____

ગ્રાહક નં. :

Cust. No.: _____

શાખા:

Branch: _____ અકાઉન્ટનો પ્રકાર: _____
Type of Account : _____

ખાતા નં. :

Account No.: _____

હું અરજદાર/રોને છેલ્લા _____ મહિના/વર્ષથી ઓળખું છું. હું અરજદાર/રોની ઓળખ, વ્યવસાય અને સરનામાની પુષ્ટિ આપું છું.

I know the applicant/s for the last _____ months / years. I confirm the Identity, Occupation and Address of the applicant/s

તારીખ:

Date: _____

પરિચયકર્તાની સહી:

Introducer's Signature : _____

સહી ચકાસનાર:

Signature verified by: _____

બેંક અકાઉન્ટ ખોલવા માટે કંપની / સોસાયટી / ટ્રસ્ટ ઇત્યાદિનો ઠરાવ
Resolution of a Company / Society / Trust etc. for opening a Bank Account

તારીખ:

D	D	M	M	Y	Y	Y	Y
---	---	---	---	---	---	---	---

Date:

બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ / સોસાયટીની મેનેજમેન્ટ કમિટી / ટ્રસ્ટની બોલાવાયેલી સભા જે
A certified copy of the Extract from the minutes of the meeting of the Board of Directors / Committee of Management of the Society / Trust of _____

_____ duly convened, at which a proper quorum was present
ખાતે યોજવામાં આવી હતી તેમાં પૂરતી સંખ્યામાં કોરમ હાજર હતા તે મીટિંગના મિનિટ્સના અંશોની પ્રમાણિત પ્રત.
held on _____

at _____

અમે આ દ્વારા પ્રમાણિત કરીએ છીએ કે

We hereby certify that the following resolution of the Board of Directors / the Committee of Management of the Society / Trust _____

ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ / સોસાયટીની મેનેજમેન્ટ કમિટી / ટ્રસ્ટ દ્વારા બોર્ડ / કમિટીની
_____ was passed at the meeting of the Board / the Committee held on _____

ખાતે યોજાયેલી મીટિંગમાં નીચે મુજબનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જે
and has been duly recorded in the minute book of the said _____

ની મિનિટ્સ બુકમાં નોંધ કરાયો છે.

આ દ્વારા ઠરાવ કરવામાં આવે છે કે કંપની / સોસાયટી / ટ્રસ્ટનું ખાતું કપોળ કો-ઓપરેટિવ બેંક લિ.,

Resolved that an account for the Company / Society / Trust be opened with The Kapol Co-operative Bank Ltd. _____

શાખામાં ખોલવામાં આવે અને બેંકને આ દ્વારા કંપની / સોસાયટી / ટ્રસ્ટ દ્વારા લખાયેલા ચેક /
_____ Branch and that the said Bank be and is hereby authorised to honour Cheque / Draft /

ડ્રાફ્ટ / અન્ય કોઈ મેન્ડેટ માન્ય કરવા અને અકાઉન્ટ સંબંધિત અન્ય કોઈપણ સૂચનોને ઓફરડ્રો કરવા કે નહીં કંપની / સોસાયટી / ટ્રસ્ટના ટ્રાન્ઝેક્શનો સંબંધિત પર કાર્ય
any other Mandate drawn by Company / Society / Trust and to act upon any instructions so given relating to the account whether the same be

કરવા અધિકૃત કરાય છે.

overdrawn or not relating to the transactions of the Company / Society / Trust.

પ્રમાણિત ટૂ કોપી
CERTIFIED TRUE COPY.

Common
Seal

સેક્રેટરી
SECRETARY

મીટિંગના ચેરમેન
CHAIRMAN OF THE MEETING

માત્ર બેંકના ઉપયોગ માટે
FOR BANK'S USE ONLY

એક્ટિવિટી કોડ નં.

Activity code No.: _____

પરિચયકર્તા ગ્રાહક નં.

Introducer's Customer No.: _____

--	--	--	--	--	--	--	--	--	--

અરજદાર/રોનું સરનામુંના આધારે પ્રમાણિત કરાયું છે

Address of the applicant/s has been confirmed on the basis of _____

ફોટા મારી ઉપસ્થિતિમાં લગાવવામાં અને સહી કરવામાં આવ્યા છે.

Photograph/s has / have been affixed and signed in my presence.

અરજદાર/પરિચયકર્તાએ મારી ઉપસ્થિતિમાં સહી કરી છે.

Applicant / Introducer has / have signed in my presence

પરિચય સ્વીકૃતિ પત્ર પરિચયકર્તાને

Introduction confirmation letter sent to the Introducer on _____

ના રોજ મોકલવામાં આવ્યો હતો. સ્વીકૃતિ

Confirmation received on _____

ના રોજ મળી સ્વીકૃતિ પત્ર પરની સહી સકાસીને પ્રમાણિત કરાઈ હતી.

Signature on confirmation letter verified.

શાખા અધિકારીની સહી અને કોડ નં.

Signature & Code no. of Branch Official.



**The Kapol
Co-operative
Bank Ltd.**

(MULTI-STATE SCHEDULED BANK)
ALL YOU WANT A BANK TO BE

શાખા : _____
Branch : _____

તારીખ : _____
Date:

D	D	M	M	Y	Y	Y	Y
---	---	---	---	---	---	---	---

ગ્રાહક નં.: _____
Customer No.: _____

ખાતા નં.: _____
Account No.: _____

ખાતાનો પ્રકાર : _____
Account Type : _____

વ્યક્તિગત માહિતી પત્રિકા (ખાતા ધારક / સંયુક્ત ખાતા ધારક / પાલક દ્વારા ભરવાની રહેશે)

Personal Information Sheet (to be filled in by Account holder / Joint A/c holder / Guardian)

(આ માહિતી તદ્દન ગોપનીય રાખવામાં આવશે)
(This information will be kept strictly confidential)

નામ : _____
Name: શ્રી. Mr. શ્રીમતી Mrs. કુ. Miss માસ્ટર Master

અટક _____ પ્રથમ નામ _____ વચ્ચળું નામ _____
Surname First Name Middle Name

જન્મ તારીખ : _____ પીએએન નં.: _____
Date of Birth: _____ Pan No.: _____

સગીર / વરિષ્ઠ વ્યક્તિ (60 વર્ષથી વધુ) માટે પુરાવા દસ્તાવેજ સાથે જોડો.
Attach Documentary evidence for Minor / Senior Citizen (above 60 years)

ઘરનું સરનામું : _____
Residential Address: _____

શહેર : _____ પિન કોડ : _____ રાજ્ય : _____
City: _____ Pin Code: _____ State: _____

ફોન નં.: _____ મોબાઈલ નં.: _____ ઈ-મેલ : _____
Tel No.: _____ Mobile No.: _____ Email: _____

ઑફિસનું સરનામું : _____
Office Address: _____

શહેર : _____ પિન કોડ : _____ રાજ્ય : _____
City: _____ Pin Code: _____ State: _____

ફોન નં. _____ મોબાઈલ નં. _____ ઈ-મેલ : _____
Tel No.: _____ Mobile No.: _____ Email: _____

ધર્મ : _____ જ્ઞાતિ : _____ દેશ : _____
Religion: _____ Caste: _____ Country: _____

વેવાહિક સ્થિતિ : _____ અવિવાહિત _____ વિવાહિત _____ બાળકોની સં.: _____
Marital Status: Single Married No. of Children: _____

શિક્ષણ : _____ નોન એસએસસી _____ એસએસસી/એચએસસી _____ અન્ડરગ્રેજ્યુએટ _____ ગ્રેજ્યુએટ _____
Education: Non - SSC SSC / HSC Undergraduate Graduate

વ્યવસાય : _____ પગારદાર _____ બિઝનેસ _____ નિવૃત્ત _____ વિદ્યાર્થી _____ ગૃહિણી _____
Occupation: Salaried Business Retired Student Housewife

_____ સ્વ-રોજગાર/વ્યાવસાયિક _____ અન્ય _____
 Self - Employed / Professional Other

જો પગારદાર હોય તો કયા ક્ષેત્રમાં છો
If salaried, employed with
 પબ્લિક લિ. કંપની _____ પ્રાઇવેટ લિ. કંપની _____
 Public Ltd. Co. Pvt. Ltd. Co.
 ગવર્નમેન્ટ _____ મલ્ટીનેશનલ _____
 Govt. Sector Multinational
 અન્ય _____
 Others _____

નિયોક્તાનું નામ : _____
Name of the Employer: _____

ગ્રેડ : _____
Grade: નોન-મેનેજમેન્ટ _____ જુનિયર મેનેજમેન્ટ _____
 Non - Management Junior Mgmt.
 મિડલ મેનેજમેન્ટ _____ ટોપ મેનેજમેન્ટ _____
 Middle Mgmt. Top Mgmt.

જો સ્વ-રોજગાર / વ્યાવસાયિક હોય તો
If Self Employed, Profession
 સીએ _____ એન્જિનિયર _____ ડૉક્ટર _____
 CA Engineer Doctor
 ટ્રેડર _____ વકીલ _____ કન્સલ્ટન્ટ _____
 Trader Lawyer Consultant
 સોફ્ટવેર અન્ય _____
 Software Others

જો બિઝનેસ હોય તો
If in Business
 પબ્લિક લિ. _____ પ્રાઇવેટ લિ. _____ ભાગીદારી _____
 Public Ltd. Pvt. Ltd. Partnership
 પ્રોપાઇટરશિપ _____ ટ્રસ્ટ _____ અન્ય _____
 Proprietorship Trust Others

માસિક પારિવારિક આવક (આશરે) રૂ.:
Monthly total family Income (approx.) Rs.:
 રૂ. 5000 સુધી _____ 5001-10000 _____ 10001-20000 _____
 Upto Rs. 5000 5001-10000 10001-20000
 20001-30000 _____ 30001-50000 _____ 50000 થી વધુ _____
 20001-30000 30001-50000 above 50000

અન્ય બેંકો સાથે બેંકિંગ સંબંધો : _____
Banking Relations with other Banks: _____

બેંકનું નામ : _____ શાખા _____
Name of the Bank: _____ Branch _____

ખાતા નં.: _____
A/c No.: _____

બેંકનું નામ : _____ શાખા _____
Name of the Bank: _____ Branch _____

ખાતા નં.: _____
A/c No.: _____

ડેબિટ/ક્રેડિટ કાર્ડ નં. બેંક : _____
Debit / Credit Card No. Bank: _____

ડેબિટ/ક્રેડિટ કાર્ડ નં. બેંક : _____
Debit / Credit Card No. Bank: _____

(16 ડિજિટનો કાર્ડ નંબર)
(16 digit card number)

પાસપોર્ટ નં.: _____
Passport No.:

D	D	M	M	Y	Y	Y	Y
---	---	---	---	---	---	---	---

ખાતે રજૂ કરાયો : _____ સમાપ્તિ તારીખ : _____
Issued at: _____ Date of Expiry: _____

માલિકીના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ Consumer Durables Ownership		<input type="checkbox"/> કોમ્પ્યુટર <input type="checkbox"/> ડિજિટલ કૅમેરા <input type="checkbox"/> પ્રોજેક્શન ટેલિવિઝન <input type="checkbox"/> કાર	માલિકીની અસ્ત્યામતો Asset Ownership	<input type="checkbox"/> માઇક્રોવેવ <input type="checkbox"/> ડીવીડી પ્લેયર <input type="checkbox"/> ઍર કંડિશનર <input type="checkbox"/> ટુ વ્હીલર	<input type="checkbox"/> એલસીડી ટેલિવિઝન <input type="checkbox"/> હોમ થિયેટર સિસ્ટમ <input type="checkbox"/> એકેચ નહીં <input type="checkbox"/> બંને
માલિકીના વાહન: Vehicle Ownership:		<input type="checkbox"/> કાર કાર મોડેલ અને મેક Car Model & Make:			
તમે હાલ રહો છો તે ઘર: The house you currently live in:		<input type="checkbox"/> ભાડાનું છે <input type="checkbox"/> કંપની તરફથી મળેલ છે	<input type="checkbox"/> પોતાની માલિકીનું છે <input type="checkbox"/> લોન લઈ ખરીદ્યું છે		

લોનનો પ્રકાર Types of Loans	લોન સુવિધા લીધી છે કે નહીં Loan facilities whether availed	છેલ્લે લોન લીધાને કેટલા વર્ષ થયા છે Number of years since you last availed the loan	આવતા 6 મહિનામાં તમે-આમાંની કોઈપણ લોન લેવા ઇરાદો ધરાવો છો ? in the next 6 months do you intend availing any of these loans ?
1. કાર Car	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No.	<input type="checkbox"/> 1 <input type="checkbox"/> 2 <input type="checkbox"/> >2	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No
2. હાઉસિંગ Housing	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No.	<input type="checkbox"/> 1 <input type="checkbox"/> 2 <input type="checkbox"/> >2	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No
3. કન્ઝ્યુમર ડ્યુરેબલ/પીસી Consumer Durable/PC	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No. હા ના	<input type="checkbox"/> 1 <input type="checkbox"/> 2 <input type="checkbox"/> >2	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No હા ના
4. બિઝનેસ Business	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No. હા ના	<input type="checkbox"/> 1 <input type="checkbox"/> 2 <input type="checkbox"/> >2	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No હા ના
5. લોન સામે લોન Loan against Shares	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No. હા ના	<input type="checkbox"/> 1 <input type="checkbox"/> 2 <input type="checkbox"/> >2	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No હા ના
6. ઇન્શ્યુરન્સ પોલિસી Insurance Policy	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No. હા ના	<input type="checkbox"/> 1 <input type="checkbox"/> 2 <input type="checkbox"/> >2	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No હા ના
7. ટ્રાવેલ અબ્રોડ Travel Abroad	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No. હા ના	<input type="checkbox"/> 1 <input type="checkbox"/> 2 <input type="checkbox"/> >2	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No હા ના
8. શૈક્ષણિક લોન Educational Loan	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No. હા ના	<input type="checkbox"/> 1 <input type="checkbox"/> 2 <input type="checkbox"/> >2	<input type="checkbox"/> Yes <input type="checkbox"/> No હા ના

અમારા વિશે તમે કેવી રીતે જાણ્યું?

How did you come to know about us ? _____

તમારી બેંક સાથે તમે અન્ય કોઈ માહિતી આપ-લે કરવા યાદો છો

Any other information you wish to share with your Bank _____

તમને પ્રમોશનલ મટીરિયલ મોકલવામાં આવી શકે છે - હા/ના

You may send promotional material - Yes / No.

હું સ્વીકૃત કરું છું કે અહીં ઉપર જણાવેલી માહિતી મારી શ્રેષ્ઠ જાણકારી મુજબ સાચી અને પ્રમાણભૂત છે.

I affirm that, information furnished herein above is true and authentic to the best of my knowledge.

તારીખ:

Date:

સહી
Signature